

ગુજરાતમિત્ર ભવિષ્ય દર્શન

ધન (ભ. ધ. ફ.)



માનસિક સ્થિતિ :

મિત્રો,

સોનાના મૃગનો જન્મ અસંભવ હોવા છતાં રામ જેવા રામ પણ એની તરફ લલચાય જાય છે, એનું કારણ જ્યારે વિપત્તિ આવવાની હોય છે ત્યારે માણસની બુદ્ધિ મલિન થઈ જાય છે. આને 'વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ જાય છે' એમ કહેવાય છે.

આપણી જિંદગીમાં નાનપણથી શરૂ કરીને જે સમય પસાર થાય છે એમાં દિવસો, મહિનાઓ અને વરસો વીતી જાય છે. ધીમે ધીમે એક વ્યક્તિ બાળક માંથી યુવાન અને યુવાનમાંથી ઘરડો થતો જાય છે. બાલ્યાવસ્થામાં લગભગ પંદર વરસની ઉંમર સુધી એનામાં પરિપક્વતા હોતી નથી એ બાળક ઘરનું વાતાવરણ, ઘરના સંસ્કાર અને આજુબાજુ ના બહારના સંજોગોમાં મોટો થતો જાય છે.

પંદર વરસની ઉંમર પછી માણસનો પોતાનો એક ચોકકસ 'સ્વ' ભાવ બનતો જાય છે. બીજા દસ પંદર વરસોમાં એ સ્વભાવ જડમૂળથી નિશ્ચિત થઈ જાય છે અને માણસ એ પ્રમાણે જીવનભર કમી કરતો રહે છે. કોઈ સેવાભાવી થાય છે, બીજાને મદદ કરનારો થાય છે, પોતે થોડું સહન કરીને કે ઘસાઘને પણ બીજાને ખુશ રાખવાનો સ્વભાવ બનાવે છે, તો કેટલાક ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવે છે. એમના સંબંધોમાં સ્વાર્થ જ હોય છે પણ સેવાનો દંભ કરતા હોય છે. બીજાને ખુશ રાખવાની વાતમાં પણ નાટક હોય છે. ફક્ત પોતાનો અહમ સંતોષાય અને છતાં પોતે ખૂબ સારા માણસ છે એવો દેખાવ સફળતાપૂર્વક કરી જાય છે. આવો 'સ્વ' ભાવ માણસ મરે ત્યાં સુધી રહે છે.

હવે અહીંથી તમારી વારતા શરૂ થાય છે.

આપને શનિની સાડાસાતી પનોતી ચાલે છે. તે સારી નથી અને આ પનોતી આખું વરસ રહેશે. આપણે માણસના પરોપકારી અને સ્વાર્થી સ્વભાવની વાત એટલા માટે કરી કે માણસ પોતાના સ્વભાવ પ્રમાણે કમી કરતો હોય છે અને એના સારા અને ખરાબ કમીનું ફળ એને પનોતી દરમ્યાન મળતું હોય છે. માણસનો સમય જ્યારે સારો ચાલતો હોય છે અને પૂણ્ય કર્મ ઉદિત થયા હોય ત્યારે જીવનમાં ખૂબ સફળતા

મળે છે. એ એમ માને છે કે આ સફળતા મારી આવડત હોશિયારીને લીધે છે. એને અભિમાન આવી જાય છે. એ દંભી બની જાય છે અને સારા ખોટાનો વિવેક ગુમાવી બેસે છે. આવા સમયમાં પોતાના સ્વાર્થ અને અભિમાનને પોષવા એ ઘણાં ખોટા કર્મો કરે છે ત્યારે એને તો એમ જ લાગે છે કે એ બધું બરાબર જ કરે છે.

આ પનોતીના સમયમાં તમારા સારા ખોટા કર્મોનો હિસાબ થતો હોય છે. પનોતીમાં વિનાશકાળે વિપરીત બુદ્ધિ સુખે છે અને માણસ દુખી થાય છે, જેમાંથી એને કોઈ બચાવી શકતું નથી. કારણ માણસે કરેલા કર્મો તો પોતે જ ભોગવવા પડે છે ને! તેવી જ રીતે માણસે કરેલા સારા કર્મોનું ફળ પણ મળતું હોય છે. પનોતી ના સમયમાં જે માણસે જીવનમાં સારા કર્મો કર્યા હશે તેના એ કર્મો એને બચાવી લેશે અને દુઃખી થવા દેશે નહીં. માટે માણસે જીવનભર સારા કર્મો જ કરતા રહેવું જોઈએ. બીજાની ખુશીને માટે જીવવું જોઈએ. પરંતુ આ વાત માણસ સમયસર સમજતો નથી.

અને પછી પનોતીના સમયમાં પસ્તાવવાનો કોઈ અર્થ નથી.

જો રામ જેવા રામને વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ જતી હોય તો આપણે તો કિસ ખેત કી મૂલી?

પછી શિષ્યએ પૂછ્યું : હે ગુરુજી: મેં તો દરરોજ શ્રી હનુમાનજીના મંદિરે જવાનું અને હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કરી દીધું છે. બરાબર છે ને?

ગુરુજીએ કહ્યું :- હે વત્સ, ઓલ લાઇન ધન ધીસ રૂટ આર બીગી!!
આર્થિક નાણાંકિય

આર્થિક દૃષ્ટિએ આ વરસનો સમય આપને માટે ખાસ્સો ઉતાર ચઢાવવાળો રહેશે. આ વરસમાં તમારું આવકનું અને જાવકનું તમે એડવાન્સમાં પ્લાનીંગ કરો કે અમૂક સમય પછી તમારે આટલો ખર્ચો આવવાનો છે અને તમે અગાઉથી એની સગવડ કરી રાખો, પણ એ પૈસા બીજા જ કામમાં વપરાય જાય અને તમારું પ્લાનીંગ ખોટું પડે. કારણ વચમાં કેટલાક આકસ્મિક ખર્ચા આવી જાય. ખાસ કરીને શેર - સહાના કામમાં આ વરસનો સમય સારો નથી. નુકશાન થઈ શકે. ટૂંકમાં આપની આવક સ્થિર રહેશે નહીં.

દંધો-વેપાર-નોકરી

કામકાજ દંધાની દૃષ્ટિએ પણ આ વરસમાં આપને મહેનત વધારે કરવી પડે તેની સામે વળતર ઓછું મળે દંધામાં બે મહિના સારા જાય તો વળી બીજા બે મહિના ખરાબ જાય. ખર્ચા - પાણી માંડ નીકળે એવું બને. દંધામાં કેટલીક અડચણો કેટલાક વિઘ્નો આવવાની શક્યતા છે. કચારેક કારીગરનો તો કચારેક મશીનરીનો પ્રોબ્લેમ આવે. આપની ઉઘરાણી પણ ફસાય જવાની શક્યતા છે. એટલે તમે પૈસાની તંગી ભોગવતા હોવ અને બીજા તમારા પૈસા વાપર્યા કરે. આ સંજોગોમાં ચાલુ દંધો બંધ કરીને બીજે કોઈ દંધો કામકાજ કરવાની ઇચ્છા થાય. દંધામાં એકસ્પાન્સન કરવાનું પ્લાનીંગ હોય તો તે અધૂરું રહી જાય. ભાગીદારીમાં દંધો હોય તો તેમાં ટેન્શન થાય.

નોકરીવાળાને માટે પણ આ વરસના ગ્રહમાન મધ્યમ છે. નોકરીમાં બહુ સ્માર્ટ થવાની કે દાદાગીરી કરવાની કોશિશ કરવી નહીં. આંખ - કાન ખુલ્લા રાખવા અને મોટું બંધ રાખીને કામ કર્યા કરવું. ઉપરી

અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લૂલૂભે મૃગાય પ્રાય: સમાપન્ન વિપત્તિ કાલે ધિયોડપિ પૂષાં મલિની ભવન્તી.

અધિકારી સાથે શિંગડા ભેરવવા નહીં. તમારા પર ખોટા આક્ષેપ આવે એવું બને. નોકરી છોડવી નહીં. પ્રમોશનમાં અને ઇન્ક્રીમેન્ટમાં તમારી અપેક્ષા કરતા ઓછું મળે. તમને અન્યાય થાય છે એવું લાગે. નોકરીમાં એક સજાના ભાગરૂપે સ્થળાન્તર થઈ શકે.

જમીન-મકાન

પ્રોપર્ટીની બાબતમાં આ વરસમાં આપના ગ્રહમાન મધ્યમ છે. અર્થાત વરસ દરમ્યાન નવી પ્રોપર્ટીમાં રોકાણ તો થઈ શકે, પરંતુ એક ટેન્શન ઓછું કરવા માટે બીજું ટેન્શન ફરજિયાત ઉભું કરવું પડે એવું બને. કોઈ પ્રોપર્ટી વેચવાની હોય તો તેમાંથી લાભ થાય. પરંતુ તમારે થોડી બાંધછોડ કરવી પડે અને તમારી અપેક્ષા કરતા ઓછી કિંમત આવે. છતાં એમાંથી છૂટી જવાનું સલાહ ભરેલું છે. બાપ દાદાની મિલકતમાંથી કશું મળવાનું હોય તો એમાં વિલંબ થાય અથવા તમને થોડો અન્યાય થાય એવું બને.

લગ્ન અને દાંપ્ત્યજીવન:

જેમને આ વરસમાં લગ્ન કરવાની ઇચ્છા હોય તેમણે આખે આખો પ્રોગ્રામ જ કેન્સલ કરવો, તો વધારે શાંતિ રહેશે. જો લગ્ન કરવાના બહુ અભરપા રાખશો તો ટેન્શન થશે. જો તમારે લવમેરેજ કરવાની ઇચ્છા હોય તો જેની સાથે લગ્ન કરવા હોય તેના લગ્નના રીસેશનમાં તમારે મહેમાન આમંત્રિત તરીકે જવું પડે તો જવાનું!

દાંપ્ત્યજીવન માટે પણ આ વરસમાં આપના ગ્રહમાન થોડા આડા અવળા છે. અર્થાત બહુ સીધા નથી. આનંદની વાત તો એ છે કે પતિ-પત્ની બંનેને એક બીજાની ચિંતા રહેશે. અને લગ્ન જીવનમાં તો એવું જ હોવું જોઈએ! છતાં બંને જણાએ એકબીજાને સમજાવવું પડે કે હું તો ઠીક છું પણ તું તારી જાતને સંભાળને! બોલો, બંને ઠીક છતાં બંનેમાં લોચા? ખાસ કરીને એપ્રિલ મહિના પછી વરસના અંત સુધી તમને તમારા પાર્ટનરની ચિંતા રહેશે. એ ચિંતા તબિયત અંગેની હોય કે બીજી કોઈપણ હોય શકે.

સંતાન

સંતાનની બાબતમાં આ વરસમાં આપને કોઈ મોટું ટેન્શન થાય એવું નથી. પરંતુ ખાસ કોઈ એક ચોકકસ બાબત અંગે તમને સતત ટેન્શન રહ્યા કરે. આમા પાછું એવું હોય કે સંતાનો તો જલસા જ કરતા હોય કારણ કે તમારા ટેન્શનની ગંભીરતાને એમને ખ્યાલ જ નહીં આવે! વરસમાં બે વખત કોઈ પર્સનલ બાબતમાં સંતાનો ડિસ્ટર્બ થાય ત્યારે તમારે બધી રીતે સપોર્ટ કરવો પડે. આ સંજોગોમાં તમારે તમારું ટેન્શન બાબુ પર મૂકીને દોડવું પડે.

અભ્યાસ:

મેં મારા મિત્રને પૂછ્યું કે તારા ટિકરાનું રિગલ્ટ શું આવ્યું? એણે કહ્યું કે છત્રીસ માર્ક્સ આવ્યા. મેં કહ્યું ચાલો સારું થયું. ખાસ તો થઈ ગયો! મારા મિત્રએ કહ્યું શું કપાળ સારું થયું? સાતે સાત વિષયના માર્ક્સનો ટોટલ સરવાળો છત્રીસ છે! તમારે અભ્યાસમાં સાવ આવું થાય એવું તો નથી. છતાં કંઈક તો છે! તમે જે વિષયમાં વધારે માર્ક્સની અપેક્ષા રાખતા હોય એમાં જ ઓછા આવે. તમે ગમે એટલી મહેનત કરો તો પણ ઓછી પડે. આગળના અભ્યાસ માટેના એડમિશનમાં ટેન્શન થાય.

સ્થળાન્તર થઈ શકે. તમારા વ્યક્તિગત ગ્રહમાન સારા હશે તો સારી સફળતા મળશે.

પ્રવાસ:

પ્રવાસ મુસાફરીની બાબતમાં આ વરસમાં આપના ગ્રહમાન સ્પેશ્યલ છે. મુસાફરીનો યોગ સારો છે. એમ કહેવા કરતા ખરયાના યોગ છે એમ કહેવું વધારે યોગ્ય છે. વરસ દરમ્યાન ત્રણ પ્રવાસ થાય એક પ્રવાસ આનંદ પ્રમોદને માટે કે હીલસ્ટેશન પર જવા માટે થાય. બીજો પ્રવાસ કોઈ સામાજિક કામને માટે ફરજિયાત કરવો પડે. ત્રીજા પ્રવાસમાં એક લાંબી મુસાફરી થાય આમાં પરદેશનો પ્રવાસ થવાની પણ શક્યતા છે. પ્રવાસમાં તમારે તમારા પૈસા, તમારી તબિયત અને તમારું મગજ સાચવીને રાખવા!

મિત્ર - શત્રુ:

મિત્રોની બાબતમાં તમારા ગ્રહમાન થોડા નિરાશાજનક છે. તમને એમ લાગે કે બધા જ સ્વાર્થી છે, મારા સિવાય! બધા જ દોસ્તીનો અને મિત્રતાનો નાટક કરે છે, મારા સિવાય! બધા મિત્રો ટેમ્પરરી જ હોય છે, કોઈ પરમેનન્ટ નથી. મારા સિવાય! આ બધી બાબતોમાં તમારા મિત્રોની જગ્યાએ તમે તમારી જાતને મૂકી જુઓ તો તમને નગ્ન સત્ય ખબર પડશે! શત્રુની બાબતમાં તો એવું છે ને કે જે તમારી પ્રશંસા નહીં કરે, જે તમારી હા માં હા નહીં બોલે એ બધા જ તમારા શત્રુ!! બોલો, પવનપુત્ર શ્રી હનુમાન કી જય! બજરંગ બલી કી જય!

જ્યારે શનિની પનોતી ચાલતી હોય છે ત્યારે આવા બધા વિચારો આવતા હોય છે.

કોર્ટ કચેરી:

આ બાબતમાં જો તમને રસ્તામાં કોઈ પોલિસવાળો સામે દેખાય તો રસ્તો બદલી નાંખવો! ઘરમાં રોકડા રૂપિયા વધારે પડેલા હોય કે કામકાજ દંધામાં તમે બહુ જાણીતી હસ્તી હોવ તો ઇન્કમ ટેક્સવાળા સાથે દોસ્તી રાખવી નહીં! કોર્ટ કચેરીમાં કોઈ કેસ ચાલુ હોય કે પેન્ડિંગ હોય તો તેમાં જેટલો વધારે વિલંબ થાય એટલું તમારા માટે ફાયદાકારક છે. હાથે કરીને જાણી જોઈને કે સામેથી તમારે કોઈ પણ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટની મેટરમાં બબાલ ઊભી કરવી નહીં. આ બધાથી દૂર રહેશો તો જ તમે શાંતિથી જીવી શકશો. નહીં તો તમને એમ લાગે કે બંધન યોગ થતા થતા રહી ગયો!

તંદુરસ્તી

તબિયતની બાબતમાં વરસ દરમ્યાન એક નાની અને એક મોટી ફરિયાદ રહેશે. નાની ફરિયાદમાં ચાર થી છ દિવસ ટ્રીટમેન્ટ કરવી પડે અને આરામ કરવો પડે. મોટી ફરિયાદમાં ચાર થી છ મહિના ટ્રીટમેન્ટ કરવી પડે અને સાચવવું પડે તબિયતમાં કોઈ એક નવી ફરિયાદ શરૂ થાય. ભૂતકાળમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય તો તે રિપીટ થાય. તમારા ભાઈ બહેનોની તબિયત અંગે ચિંતા રહેશે ભાઈ બહેનોમાંથી કોઈ એકાદ વ્યક્તિને સિસ્ટિસ પ્રોબ્લેમ થઈ શકે. જેવી હરિ ઇચ્છા! આ વરસમાં તમને કોઈ ઓપરેશન થઈ શકે એવી શંકા રહેશે. જો તમારા વ્યક્તિગત ગ્રહમાન વધારે ખરાબ હોય તો તમારી શંકા સાચી પડે.